

ભારતીય જનતા પાર્ટી

ગુજરાત પ્રદેશ

શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

પ્રેસનોટ

તા. ૧૬.૦૩.૨૦૧૯

છેલ્લા ૩ દિવસથી પ્રદેશ નિરીક્ષકો દ્વારા ૨૬ લોકસભાના ઉમેદવારો અંગે
સૂચનો - અભિપ્રાયો લેવાનું હિયરીંગનું કામ ચાલુ હતું, જે આજે પૂર્ણ થયું છે.

આવતીકાલે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા લોકસભા ચૂંટણી પ્રભારી શ્રી ઓમજી માથુર,
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં
લોકસભા ચૂંટણી સમિતિની બેઠક મળશે

આવતીકાલથી ૧૭, ૧૮, અને ૧૯ માર્ચ એમ, ત્રણ દિવસ ચાલનારી લોકસભા ચૂંટણી સમિતિ બેઠકમાં ગુજરાતની ૨૬
લોકસભા બેઠકોના નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કાર્યકરોના સૂચનો તથા અભિપ્રાયો અંગેનો અહેવાલ લોકસભા
ચૂંટણી સમિતિ સામે રજુ કરવામાં આવશે - શ્રી ભરતભાઈ પંડ્યા

ભાજપા પ્રદેશ પ્રવક્તાશ્રી ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૩ દિવસથી તા.૧૪,૧૫,૧૬ માર્ચના રોજ
જે તે લોકસભા જઈને પ્રદેશ નિરીક્ષકો દ્વારા ૨૬ લોકસભાના ઉમેદવારો અંગે સૂચનો-અભિપ્રાયો લેવાનું હિયરીંગનું કામ
ચાલુ હતું, જે આજે પૂર્ણ થયું છે. આવતીકાલે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા લોકસભા ચૂંટણી પ્રભારી શ્રી
ઓમજી માથુર, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં લોકસભા
ચૂંટણી સમિતિની બેઠક મળશે. આવતીકાલથી ૧૭, ૧૮, અને ૧૯ માર્ચ એમ, ત્રણ દિવસ ચાલનારી લોકસભા ચૂંટણી
સમિતિ બેઠકમાં લોકસભાના નિરીક્ષકો અને જલ્લા સંકલન સમિતિ સહિત મુખ્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉમેદવારો
અંગે ચર્ચા વિચારણાં થશે.

શ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે, આવતીકાલે ૧૭ માર્ચ, રવિવારના રોજ વડોદરા, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર,
દાહોદ, વલસાડ, નવસારી, બારડોલી, સુરત, આણંદ અને ખેડા એમ, કુલ ૧૧ બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવશે.

તારીખ ૧૮ માર્ચ, સોમવારના રોજ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, અમરેલી,
ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ, કુલ ૧૧ બેઠકોની સમીક્ષા હાથ
ધરવામાં આવશે, અને

તારીખ ૧૯ માર્ચ, મંગળવારના રોજ બાકી રહેલ રાજકોટ, કર્ણ, પોરબંદર અને જુનાગઢ એમ, ૪ બેઠકોની
સમીક્ષા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ગુજરાત લોકસભા ચૂંટણી સમિતિ લોકસભા બેઠકદીઠ સંભવિત નામોની યાદી
તૈયાર કરી કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ રજુ કરશે તેમ શ્રી પંડ્યાએ અંતમાં જણાવ્યું હતું.

(પ્રશાંત વાળા)

પ્રદેશ કન્વીનર, મીડીયા વિભાગ